

રીન્યુઅલ વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા

- જે વિદ્યાર્થીએ વર્ષ ૨૦૧૯-૨૦ માં છાત્રાલયમાં પ્રવેશ મેળવેલ હોય, તેનો અભ્યાસક્રમ ત્રણ કે ચાર વર્ષનો હોય, ત્યાર બાદ અભ્યાસના વર્ષમાં ગેપ પડેલ ન હોય ગત વર્ષમાં છાત્રાલયમાં રહેતો હોય તેમજ વર્ષ ૨૦૨૧-૨૨ માં કોલેજમાં પ્રવેશ મેળવેલ હોય તેને રીન્યુઅલ વિદ્યાર્થી કહી શકાય અને તે જ વિદ્યાર્થી રીન્યુઅલ તરીકે અરજી કરી શકશે.
- ગત વર્ષ ની વાર્ષિક પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.
- સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા રીન્યુઅલ વિદ્યાર્થીઓ esamajkalyan.gujarat.gov.in ઉપર ફરજિયાત ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- કુમાર તથા કન્યા છાત્રો માટે આવક મર્યાદા વાર્ષિક રૂ.૫૦ લાખ રહેશે. કન્યા છાત્રો માટે ઓછી આવકવાળાને અગ્રતા આપવાની રહેશે.
- વિદ્યાર્થીને ગત વર્ષનું વાર્ષિક પરીણામની નકલ યુનિવર્સિટીમાંથી મળવામાં ન હોય તો ગત વર્ષના છેલ્લા સેમેસ્ટરની નકલ અપલોડ કરવાની રહેશે અને તેમાં દર્શાવેલ ગુણની ટકાવારી દર્શાવવી. વાર્ષિક પરિણામની નકલ મળ્યેથી તુરત જ છાત્રાલયમાં મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે અને ગુણની નિયત ટકાવારી હશે તો જ ફાઇનલ પ્રવેશ આપવામાં આવશે.
- ગત વર્ષ કે અગાઉના વર્ષોમાં છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીનું વર્તન, રહેણી-કરણી, વિગેરે ચકાસીને તેનો છાત્રાલયમાં પ્રવેશ સુનિશ્ચિત કરવામાં આવશે.
- વેબ સાઇટ પર દર્શાવેલ વિગતો તેમજ વિદ્યાર્થી પાસે રહેલ ડોક્યુમેન્ટમાં દર્શાવેલ વિગતોનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ પ્રવેશ અરજી ફોર્મ ભરવાનું રહેશે. એક વાર સબમીટ કર્યા બાદ અરજીમાં કોઈ કોલમ કે વિગતોમાં સુધારો/વધારો કરી શકશે નહીં.
- અરજીમાં અધુરી વિગતો કે ખોટી વિગતો દર્શાવવામાં આવેલ હશે. તો તેની અરજી રદ ગણવામાં આવશે અને તે અંગેની જાણ વિદ્યાર્થીને કરવામાં આવશે નહીં.
- અગાઉની સુચનાઓ/સરકારશ્રીના નિયમો છાત્રાલયમાં પાળવાના નિયમો વિગેરે યથાવત રહેશે અને વિદ્યાર્થીઓએ તેનું પાલન કરવાનું રહેશે.
- પ્રવેશની અરજી કરવાથી વિદ્યાર્થીએ છાત્રાલયમાં પ્રવેશ માટે હક્કદાવો કરી શકશે નહીં. સરકારશ્રીએ નક્કી કરવામાં આવેલ ધારા-ધોરણો અને નિયમો મુજબ પાત્રતા ધરાવતા હશે તો જ તેને પ્રવેશ આપવામાં આવશે.
- આપની પ્રવેશની અરજી મંજૂર કર્યા બાદ સરકારશ્રીની સુચના મુજબ છાત્રાલય શરૂ કરવામાં આવશે ત્યાર બાદ જ વિદ્યાર્થીને છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે.
- છાત્રાલયમાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને પ્રમાણપત્રોની ચકાસણી કરી પ્રવેશ આપવાની, છાત્રાલય ફેરફાર કરવાની તથા ગત વર્ષના ચારીત્ર્ય અને વર્તણૂકને આધારે પ્રવેશ રદ કરવાની એમ પ્રવેશ સંબંધિત તમામ સત્તાઓ જિલ્લા કક્ષાની છાત્રાલય પ્રવેશ સમિતિની રહેશે.
- પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી મુળ ગુજરાતનો વતની હોવો જોઈએ.
- છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.
- છાત્રાલય જે જિલ્લામાં જે સ્થળે આવેલ હોય તે કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે.
- ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં.
- છાત્રોએ સમયાંતરે ઉક્ત વેબસાઇટ જોવાની રહેશે. સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે esamajkalyan.gujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી કર્યા બાદ છાત્રને પ્રમાણપત્રોની ચકાસણી અંગે SMS અને E-mail મારફત જાણ કરવામાં આવશે.
- સરકારી છાત્રાલય અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.
- છાત્રાલયમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ખાતા/સરકારશ્રીએ નક્કી કરેલ વખતોવખતના નીતિ નિયમોનું પુરેપુરી રીતે પાલન કરવાનું રહેશે.
- સરકારશ્રીની Covid-19 ની ગાઈડલાઇન તથા છાત્રાલયની ક્ષમતાને ધ્યાને રાખી રીન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ અંગે વિદ્યાર્થી કોઈ હક્ક દાવો કરી શકશે નહીં.